

Proactive Disclosure of Vadodara Smartcity Development Ltd.

(1) સંસ્થા, કામગીરીઓ અને ફરજોની વિગતો:


કામગીરીઓ/ફરજો:

સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં વડોદરા શહેરની પસંદગી બીજ રાઉન્ડમાં કરવામાં આવેલ હતી. જેમાં 1783.72 કરોડના કુલ 51 પ્રોજેક્ટ લેવામાં આવ્યા હતા. જેમાં PPP, Convergence તથા સ્માર્ટસીટી ફુંડના પ્રોજેક્ટ સામેલ છે. હાલના તબક્કે તમામ પ્રોજેક્ટ DPR Stage થી આગળ વધી ચુક્યા છે. જેમાં 45 પ્રોજેક્ટ થઈ ચુક્યા છે, 5 પ્રગતિ હેઠળના છે, તથા 1 ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

વડોદરા સ્માર્ટસીટી ઉવલપમેન્ટ લીમીટેડ અંતર્ગત કુલ 1783.72 કરોડના પ્રોજેક્ટ PPP Convergence અને સ્માર્ટસીટી ફુંડ અંતર્ગત કાર્યરત છે. જેમાં PPP પ્રોજેક્ટ 483.80 કરોડના Convergence પ્રોજેક્ટ 355.92 કરોડના અને સ્માર્ટસીટી પ્રોજેક્ટ 944 કરોડના સામેલ કરવામાં આવેલ છે. જેમાં સ્માર્ટસીટીના 944 કરોડમાં કેન્દ્ર સરકારનો 50% ફાળો તેમજ રાજ્ય સરકારનો 25% ફાળો અને વડોદરા મહાનગરપાલિકાનો 25% ફાળો ભાગરૂપે રાખેલ છે.

(2) બોર્ડ ઓફ ડિરિક્ટર્સ તેમજ અધિકારીઓ ના નામ, તથા હોદ્દાની વિગત.

અનું ક્રમ નંબર	અધિકારીઓના નામ	હોદ્દો
૧.	શ્રી બંધાનિધીપાણી (IAS.)	ચેરમેન
૨.	શ્રી હિતેન્દ્ર પટેલ	ડાયરેક્ટર
૩.	શ્રી એચ જે. પ્રજાપતિ	ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર
૪.	શ્રી અદ્યેશ મજમુદાર	ડાયરેક્ટર
૫.	શ્રી રાજકુમાર બેનિવાલ	ડાયરેક્ટર
૬.	શ્રીમતી શ્રેયા દલવાડી	ડાયરેક્ટર
૭.	શ્રી મનિષ ભટ	જનરલ મેનેજર આઈ.ટી.
૮.	શ્રીમતી. કાજલ જયરવાલ	ચીફ ફાયનાન્સીયલ ઓફિસર



❖ કુર્મચારીઓના નામ, હોદ્ડો, પગાર તથા કામગીરીની વિગત.

અનુક્રમ નંબર .	નામ	હોદ્ડો, બેઝીક પગાર (ઉચ્ચક માસિક)	કામની વિગત
૧	કાજલ જયરસ્વાલ	Chief Financial Officer (Rs. 90,000)	Head of Finance /Account Department
૨	જનક જોશી	GIS Specialist (Rs.73,205)	Geographical Information System તથા Day to Day geographical collection ને લગતી કામગીરી.
૩	અશ્વિની મુદાલિયાર	GIS Expert (Rs.73,205)	GIS based proper survey તથા Layer ને લગતી કામગીરી.
૪	હીના ચૌધરી	HR Executive (Rs.30,000)	-Company માં Employees ના HR, અને Administration ની કામગીરી. -જાહેર માણીતી અધિકારી ની કામગીરી.
૫	અશોક પટેલ	Programmer (Rs.43,923)	Software Integration ની કામગીરી.
૬	શિલપા કાપડિયા	Help Desk Executive (Rs.19,000)	દરેક કેમેરા તથા device maintaining & managing માટેની કામગીરી.
૭	હિમાંશુ ધોબી	Help Desk Executive (Rs.19,000)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૮	સુરેશ પરમાર	Help Desk Executive (Rs.19,000)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૯	વિશાલ ગોહિલ	Help Desk Executive (Rs.19,000)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૦	ધવલ મકવાના	Help Desk Executive (Rs.19,000)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૧	ચિરાગ પટેલ	Help Desk Executive (Rs.19,000)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૨	હિમિલ પટેલ	Help Desk Executive (Rs.17,303)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૩	દિપિકા શિશોદિયા	Help Desk Executive (Rs.17,303)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.



૧૪	હાઇટ રબારી	Help Desk Executive (Rs.17,303)	દ્રેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૫	રોનક જે. શાહ	Network Administrator (Rs.48,582)	Managing & Maintaining Network, Server, and Hardware Of VMC and VSCDL
૧૬	રાજેશ મિસ્ત્રી	Network Administrator (Rs.39,930)	Managing & Maintaining Network, Server, and Hardware Of VMC and VSCDL
૧૭	રાજેન્દ્ર શાહ	Heritage Expert (Rs.10,000)	હેરિટેજ ને લગતી કામગીરી

૩) નિરિક્ષણ અને જવાબદારીના સાધનો સહીત નિશ્ચેય લેવાની પ્રક્રિયા સમક્ષ મંજુરી મેળવતી વખતે મુખ્યત્વે નીચે પ્રમાણે કાર્ય પદ્ધતિ હાથ ધરવામાં આવે છે.

- સંબંધિત દફૃતરના સ્ટાફ દ્વારા કચેરીના CFO/CS ની સમક્ષ ફાઈલ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર નિશ્ચેય લેવાની જવાબદારી CEO VSCDL ની હોય છે.

૪) પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરાયેલા ધોરણો :

-વિભાગ મા રોજ-બરોજ ના કાર્યો પાર પાડવા MOUD, Delhi, Smartcity guidelines અનુસાર કાર્યો કરવા ના હોય છે. આ ઉપરાંત સરકાર શ્રી દ્વારા સમ્યે સમ્યે બહાર પાડવામાં આવતી મૌખિક / લેખિત સુચનાઓ/ આદેશો નું અમલિકરણ રોજંદી ફરજો બજાવવા માટે કરવામાં આવે છે.

૫) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો સૂચનાઓ નિયમ સંગ્રહો અને રેફોર્ડો:

-વિભાગની મુખ્ય કામગીરી Approval projects પર કાર્યો કરવા ની રહે છે. આ કામગીરી સ્માટોસીટી ગાઈડ લાઈન અનુસાર કરવામાં આવે છે.

૬) પોતાના દ્વારા અથવા અંકુશ હેઠળ રખાયેલ વિવિધ કેટેગરીના દસ્તાવેજોનું નિવેદન :

-કચેરીઓની કાર્યપદ્ધતિમાં મૂળભૂત રજીસ્ટરો જેવાંકે ઈનવોડ, આઉટવોડ રજીસ્ટર અને શેચિપ્ટ બીલ રજીસ્ટર તેમજ પેમેન્ટ રજીસ્ટરની નિભાવની કરવામાં આવે છે.



૭) તેની નીતિ દ્વારા અથવા તેના અમલીકરણ સંબંધિત જાહેર જનતાના સભ્યો દ્વારા રજુઆત કરાયેલી અથવા તેની ચર્ચા માટે રહેલી કોઈપણ પ્રકારની વ્યવસ્થાની વિગતો :

-તેની નીતિ દ્વારા અથવા તેના અમલીકરણ માટે કંપની ના Article of Association નિયમો મુજબ કરવામાં આવે છે.

૮) પોતાના ચલાણના હેતુ માટે અથવા તેના ભાગ તરીકે રચાયેલી બે કે તેથી વધુ વ્યક્તિઓ દરાવતાં બોર્ડસ, કાઉન્સિલ કમિટિઓ અને અન્ય મંડળોનું નિવેદન અને બોર્ડસ કાઉન્સિલ કમિટિઓ અને અન્ય મંડળોની બેઠકો જાહેર પ્રજા માટે ખુલ્લી છે કે કેમ ? અથવા આવી બેઠકની વિગતો જાહેર પ્રજા મેળવી શકે કે કેમ ?

-પોતાના ચલાણના હેતુ માટે અથવા તેના ભાગ તરીકે રચાયેલી બે કે તેથી વધુ વ્યક્તિઓ દરાવતાં બોર્ડસ, કાઉન્સિલ કમિટિઓ અને અન્ય મંડળોનું નિવેદન અને બોર્ડસ કાઉન્સિલ કમિટિઓ અને અન્ય મંડળોની બેઠકો જાહેર પ્રજા માટે ખુલ્લી નથી.

૯) પોતાના આધિકરીઓ અને કર્મચારીઓની ડિરિક્ટરી :

- મુદ્દા નંબર ૨ માં સમાયેલી યાદી મુજબ.

૧૦) તેના નિયમમાં પુરી પડાયેલ પડતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ માસિક પગાર :

-માસિક પગાર અંગેની વિગત મુદ્દા નં. ૨ ના લીસ્ટમાં આવરી લેવામાં આવેલ નથી.

૧૧) તમામ યોજનાઓ ની વિગતો, સુચિત ખર્ચાઓ અને કરાયેલ ચુકવાણીના અહેવાલો દર્શાવતા તેની તમામ એજન્સીને ફ્રાગવેલ બજેટ :

-જેતે નાણાકીય વર્ષ માટેના મંજુર થયેલ બજેટ અને એપ્રુવ સ્ટેસ્યુટરી ઓડીટ રીપોર્ટસ

૧૨) ફ્રાગવાયેલી રકમ અને આ કાર્યક્રમોથી ફાયદો મેળવનારની વિગતો સહિત સબસીટી સહિત કાર્યક્રમોનો અમલનો પ્રકાર :

-લાભાર્થીઓને લગતી માહિતી કચેરીને લાગુ પડતી નથી.

૧૩) તેના દ્વારા અપાયેલી છૂટછાટો, પરવાનગીઓ અને સત્તા સૌંપણી મેળવનારની વિગતો:

-સ્માર્ટસીટી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ છૂટછાટો પરવાનગીઓ કે અધિકૃતકરણ કરવામાં આવતું નથી.



૧૪) ઈલેક્ટ્રોનીક્સ ફોર્મ્સમાં ઘડાયેલી તેના દ્વારા રાખ્યેલી અથવા તેને ઉપલબ્ધ

માહિતીના સંદર્ભની વિગતો :

-વડોદરા સ્માર્ટસીટી અંતર્ગત કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનીક્સ ફોર્મ વેબસાઈટ પર રાખવામાં આવે છે.

“<http://vadodarasmartcity.in>”

૧૫) પુસ્તકાલય અથવા વાંચનખંડના કામના કલાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો, જો જહેર ઉપયોગ માટે તેની જગતાણી કરાઈ હોય તો :

-શાખામાં પુસ્તકાલય અથવા વાંચનખંડ ઉપલબ્ધ નથી.

૧૬) જહેર માહિતી / અપીલ અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો :

(1) જહેર માહિતી અધિકારી

HR EXECUTIVE (VSCDL)

મો-૯૮૭૯૬૪૩૭૮૦

(2) અપીલ અધિકારી

C.F.O (VSCDL)

મો- ૯૮૭૯૬૪૩૭૯૮

૧૭) સૂચવી શક્ય તેવી અન્ય કોઈ માહિતી અને ત્યારબાદ દર વર્ષે આ પ્રકાશનમાં સુધારા કરાશે.

-કામો સંબંધિત મહિતી મંજુર થયેલ બજેટ ને અનુલક્ષી ને આવી જાય છે.

